

વેચાણ દસ્તાવેજ

આજ રોજ તારીખ : _____ ને _____ વારના
રોજ " આયાત પેલેસ " નામની યોજનામાં _____ વીંગમાં _____ ફ્લોર
ઉપર આવેલ ફ્લેટ/દુકાન/ઓફીસ નંબર : _____ નો રૂા. _____
/- માં વેચાણ દસ્તાવેજ.....

લખી લેનાર / વેચાણ રાખનાર / પ્રથમ પક્ષવાળા :

- (૧) _____,
ઉ.વ.આ._____, ધંધો : _____, (PAN : _____)
- (૨) _____,
ઉ.વ.આ._____, ધંધો : _____, (PAN : _____)
રહેવાસી : _____

(જેમને હવે પછી સદર વેચાણ દસ્તાવેજમાં "પ્રથમ પક્ષવાળા" અથવા "વેચાણ રાખનાર" અથવા "એલોટી" અથવા "તમો" તે રીતે સંબોધવામાં આવેલ છે. જે શબ્દના અર્થમાં પ્રથમ પક્ષવાળા અને / તથા તેઓના વંશ, વાલી, વારસો, સકસેસરો, એસાઈનીઓ, એકઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો, ઈત્યાદી તમામનો સમાવેશ થાય છે.)

લખી આપનાર / જમીન માલિક / બીજા પક્ષવાળા :

અસીમ ઈકબાલભાઈ મારફતિયા, ઉ.વ. આ. ૪૦, ધંધો : વેપાર, મુ. જુનાગઢ, ઠે. અલ અકબર એપાર્ટમેન્ટ, ચોથા માળે, ચિતાખાના ચોક, નજીક "બી" ડીવીઝન પોલીસ સ્ટેશન સામે, તા./ જી. જુનાગઢ.

પાન કાર્ડ નં. AKJPM1347H.

(જેમને હવે પછી સદર વેચાણ દસ્તાવેજમાં "બીજા પક્ષકાર" અથવા "વેચાણ આપનાર" અથવા "પ્રયોજક" અથવા "પ્રમોટર" અથવા "અમો" તે રીતે સંબોધવામાં આવેલ છે. જે શબ્દના અર્થમાં બીજા પક્ષવાળી ભાગીદારી પેઢીના હાલના તથા વખતોવખતના હયાત ભાગીદાર તથા નવા જોડાયેલ ભાગીદારો અને / તથા તેઓના વંશ, વાલી, વારસો, સકસેસરો, એસાઈનીઓ, એકઝીક્યુટો, એડમીનીસ્ટ્રેટરો, ઈત્યાદી તમામનો સમાવેશ થાય છે.)

સદર વેચાણ દસ્તાવેજ અમો / બીજા પક્ષવાળા મળી તમો / પ્રથમ પક્ષવાળાને અમો તમામની રાજીખુશીથી લખી આપીએ છીએ કે.....

મિલ્કતના ટાઈટલની વિગત :-

(૧) જુનાગઢ જિલ્લાના, જુનાગઢ તાલુકાના ગામ જુનાગઢમાં મ.ન.પા. હદની અંદર મહોલ્લે બુકર ફળીયામાં આવેલ ઘરભેણી સનંદ નંબર-૩૫૭/૯૬ વાળી સનંદ ખાનશ્રી સરદારખાનજી તથા ફતેખાનજી હાજી મહંમદખાનજીના નામની તારીખ. ૩/૩/૧૯૪૧ ના રોજ કાઢી આપવામાં આવેલ હતી, અને તે સનંદમાં દર્શાવ્યા અનુસાર સદર મિલ્કતના કિતા નં. ૨૨, ટીકકા માપણી નં. ૫૬૪ આવેલ છે, અને ક્ષેત્રફળ ચોરસ ગજ ૮૨૪-૧૩-૨૧૥ તસુ રૂકકા (સનંદ) માં દર્શાવેલ છે.

(૨) ત્યારબાદ સદરહુ મકાન ફતેખાનજી હાજીઆમદખાનજી તથા ગુ. સરદારખાનજી હાજીમહંમદખાનજીના વારસ પુત્રો હુસેનખાનજી, મહંમદખાનજી, હસનખાનજી એમ તે ચારેય જણા પાસેથી ર.કે.નં. ૩૨૦/૨૦૦૫ થી જુનાગઢના રહીશ શેખ બાઈ મોતીબેન સફરભાઈએ તા. ૧૯/૮/૧૯૪૯ ના રોજ રજી. વેચાણ દસ્તાવેજથી વેચાણ લીધેલ હતી.

(૩) ત્યારબાદ સદરહુ મિલ્કત, તેના માલિક મોતીબેન સફરભાઈ પાસેથી દસ્તાવેજ અનુ.નં. ૭૧, તા.૨૦/૧/૧૯૬૧ ના રોજથી શ્રી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટ ટ્રસ્ટ એ વેચાણ રાખેલ.

(૪) ત્યારબાદ ઉપરોક્ત વિગતે દર્શાવેલ સી.સ.બ્લોક નં. ૨૨, સી.સ.નં. ૫૬૪ વાળી મિલ્કત વેચાણ કરવા માટે શ્રી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટએ ચેરિટી કમિશનર, રાજકોટ પાસેથી મંજૂરી માંગતા ચેરિટી કમિશનર રાજકોટના હુકમ નંબર : ૩૬.૪૧.૯૨/૨૮૬૩/ ૧૯૯૩ મુજબથી વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવતા સદર મિલ્કત તે સંસ્થા એટલે કે શ્રી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટના મંત્રી / કમિટી મેમ્બર્સએ તા. ૨૯/૭/૧૯૯૩ ના રોજ વલ્લભભાઈ ખોડાભાઈ લાખાણીને અધિકાર આપેલ, જેથી તે સંસ્થાના નિયામક દરજજે વલ્લભભાઈ ખોડાભાઈ લાખાણી પાસેથી દસ્તાવેજ અનુ.નં. ૨૩૩૫, તા.૩૦/૭/૧૯૯૩ ના રોજથી શ્રી ઝરીનાબાઈ અ. રહેમાન એ વેચાણ રાખેલ. તેઓના નામે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ નંબર-૨૪૭/૧૯૯૫ મુજબથી નોંધ થયેલી.

(૫) ત્યારબાદ સદર સી.સ.બ્લોક નં. ૨૨, સી.સ.નં. ૫૬૪ ની જમીનના માલિક ઝરીનાબાઈ અ. રહેમાન (તે ઈકબાલભાઈ મોહંમદભાઈ મારફતિયા ના પત્ની) નું તા. ૪/૭/૨૦૧૪ ના રોજ અવસાન થતા તેના વારસદારો તરીકે (૧) ઈકબાલભાઈ મોહંમદભાઈ મારફતિયા (પતિ), (૨) અસ્ફાક ઈકબાલભાઈ મારફતિયા (પુત્ર), (૩) અસીમ ઈકબાલભાઈ મારફતિયા (પુત્ર), (૪) ફરઝાના ઈકબાલભાઈ મારફતિયા, (પુત્રી) આવેલા હોય, તેઓના નામે પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી નં. ૬૧૭૯/૨૦૧૫ મુજબથી વારસાઈ નોંધ થયેલી.

(૬) ત્યારબાદ ઉપરોક્ત દર્શાવેલ મિલ્કતના અન્ય માલિકો (૧) ઈકબાલ મોહંમદ મારફતિયા (પતિ), (૨) અસ્ફાક ઈકબાલભાઈ મારફતિયા (પુત્ર), (૩) ફરઝાના ઈકબાલભાઈ મારફતિયા (પુત્રી) એ આ મિલ્કત પરત્વેનો તમામ હકક હિસ્સો બીન અવેજી રીલીઝ ડીડ દસ્તાવેજ /ફારગતિ દસ્તાવેજ અનુ.નં. ૫૧૫૦, તા.૯/૭/૨૦૧૮ મુજબથી અસીમ ઈકબાલભાઈ મારફતિયાની તરફેણમાં કરી આપતા આ બાબતની પ્રોપર્ટી કાર્ડમાં નોંધ નંબર-૮૩૩૩, તા.૬/૮/૨૦૧૮ ના રોજથી થયેલ છે, આમ આ રીતે આ મિલ્કત માલિક તરીકે અસીમ ઈકબાલભાઈ મારફતિયા થયેલા છે.

(૭) ત્યારબાદ ઉપરોક્ત દર્શાવેલ મિલ્કતનું જુનવાણી બાંધકામ તોડી પાડવા માટે તેના માલિક અસીમ ઈકબાલભાઈ મારફતિયા જુનાગઢ મ.ન.પા. કચેરીમાંથી બાંધકામ પાડવાની મંજૂરી નંબર : જુ.મ.ન.પા./એન્જી./જા.નં. ૬૮૭, તા. ૧૫/૧/૨૦૨૧ મુજબથી ઈમલો ઉતારવાની મંજૂરી મેળવી તેનો ઈમલો ઉતારાવી નાખેલ અને ત્યારબાદ નવી બાંધકામ મંજૂરી નંબર : જે.એમ.સી. /૦૭-૦૯-૨૦૨૧/૧૮૩૦૫૧૩/ ૦૧/૦૨૮૪૬૩, તા. ૧૦/૯/૨૦૨૧ મુજબથી મેળવી તેમાં નવું બાંધકામ કરેલ છે, જે બિલ્ડીંગ "આયાત પેલેસ" ના નામથી ઓળખાતું આવેલ છે, સદર મંજૂરીની મુદત પૂર્ણ થતા રીન્યુઅલ મંજૂરી મ.ન.પા. કચેરી જુનાગઢ ખાતેથી તેના પત્રાંક નં. જુ.મ.ન.પા./ટી.પી./એન્જી/ જા.નં. ૬૪૫, તા. ૨૧/૧૧/૨૦૨૨ મુજબથી આપવામાં આવેલ છે.

(૮) આમ ઉપરોક્ત વિગતે જુનાગઢ જીલ્લાના જુનાગઢ તાલુકાના ગામ જુનાગઢ માં મહાનગરપાલીકા હદની અંદર મહોલ્લે બુકર ફળીયા એરીયામાં આવેલ જુનાગઢ સીટી સર્વે બ્લોક નંબર-૨૨, સીટી સર્વે નંબર-૫૬૪ ની જમીન ચોરસ મીટર ૩૦૬-૩૯-૫૧ આ. ની જમીન ઉપર રહેણાંક હેતુ માટે "આયાત પેલેસ" નામના બહુમાળી બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવેલ અને હાલ જે "આયાત પેલેસ" નામે ઓળખાય છે. આમ ઉપરોક્ત વિગતે સદરહુ જમીન ઉપર રહેણાંક હેતુ માટે "આયાત પેલેસ" નામના બહુમાળી બિલ્ડીંગનું બાંધકામ કરેલ અને તેની તમામ પ્રકારની વ્યવસ્થા કરવાનો હકક અને અધિકાર છે.

જત સદર અમો / બીજા પક્ષવાળા / લખી આપનારા જમીન માલિક ભેગા મળી તમો / લખી લેનારને નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલ્કત રૂા._____/— અંકે રૂપીયા _____ પુરામાં વેચાણ આપીએ છીએ. જે અવેજની રકમ નીચેની વિગતેથી મળી ગયેલ છે. તેના બદલમાં સદર વેચાણ દસ્તાવેજ લખી આપવામાં આવે છે.

અવેજની વિગત :-

/૧/ રૂા._____/— તારીખ _____ ના રોજ

- (અંકે રૂપીયા _____ પુરા)
- /૨/ રૂ. _____ /- તારીખ _____ ના રોજ
- (અંકે રૂપીયા _____ પુરા)
- /૩/ રૂ. _____ /- તારીખ _____ ના રોજ
- (અંકે રૂપીયા _____ પુરા)

ઉપરોક્ત અવેજની વિગતમાં જણાવેલ ચેક બેંકમાં પાસ થયેથી તેના બદલામાં પરિશિષ્ટમાં જણાવેલ મિલ્કત તમોને વેચાણ આપેલ છે અને તેનો પ્રત્યક્ષ કબજો અમો / લખી આપનારે, તમો / લખી લેનારને બાંધકામ પુર્ણ થયેથી આપવાનો રહેશે અને તમો લખી લેનારે તે સમયે સદર પરિશિષ્ટમાં જણાવેલ મિલ્કતનો રૂબરૂ અને પ્રત્યક્ષ કબજો માલિકી હકકે સંભાળવાનો રહેશે.

(૧) સદર જમીન મિલ્કત ઉપર કોઈપણ વ્યક્તિ, બેંક, શ્રોફ યા નાણાંકીય સંસ્થાનો ચાર્જ, ગીરો, બોજો કે લીયન કે સુખાધીકાર અગર તો કોઈપણ પ્રકારનો કોઈપણ હકક કે અધિકાર અમો / લખી આપનારે ઉભો કરેલ નથી. તેમજ સદર જમીન મિલ્કત અમોએ અન્ય કોઈને જામીનગીરીમાં લખી આપેલ નથી કે તેના ઉપર કોર્ટનો મનાઈ હુકમ કે એટેચમેન્ટ નથી. સદર જમીન મિલ્કત અંગે અમોએ કોઈપણ પ્રકારના વેચાણ કે ટ્રાન્સફર કરવા અંગેનો કરાર, બનાખતથી કે ભેટ કરારથી કે લેખીત યા મૌખિક અન્ય કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે વ્યક્તિના સમુહની તરફેણમાં કરી આપેલ નથી. અમો/લખી આપનારે તમોને વેચાણ આપેલ મિલ્કતના ટાઈટલ કિલયર અને માર્કેટેબલ છે તેવો પાકો ભરોસો અને વિશ્વાસ આપીએ છીએ. તેમ છતાં સદર જમીન મિલ્કતના ટાઈટલ અંગે કોઈપણ જાતનો વાંધો અગર તકરાર યા અડચણ ઉભી થાય તો તે તમામ હકકો અમો/લખી આપનાર તમોને અમારા ખર્ચે દુર કરાવી આપીશું. જો તે તમામરે દુર કરવા યા કરાવવાનો પ્રસંગ આવે તો તે અંગેનો તમામ ખર્ચ અમો / લખી આપનાર તમોને તાત્કાલીક કોઈપણ પ્રકારની તકરાર સિવાય ચુકવી આપવા માટે બંધાયેલા છીએ તેની બાંહેધરી અને વિશ્વાસ આપવામાં આવે છે.

(૨) સદર જમીન મિલ્કત અંગેના આજદીન સુધીના તમામ સરકારી તેમજ અર્ધ-સરકારી વેરા, લોકલ ઓથોરીટીના ટેક્સ તથા રેવન્યુ ટેક્સ અમોએ ભરેલા છે અને સદર વેચાણ દસ્તાવેજ થયા બાદના તમામ વેરા તથા ટેક્સ તમો/વેચાણ લેનારે ભરવાના રહેશે. પરંતુ સદર વેચાણ દસ્તાવેજ થયા બાદ ભવિષ્યમાં દસ્તાવેજ તારીખ પહેલાનો જો કોઈ વેરા અથવા ટેક્સ બાકી નીકળી આવશે તો તે તમામ રકમ અમો / લખી આપનારે ભરવાની રહેશે તેવી બાંહેધરી અને વિશ્વાસ આપવામાં આવે છે. સદર વેચાણ

દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી, લખાઈ ફી લાગુ પડતા સરકારી અને અર્ધસરકારી ટેક્ષો, લોકલ ઓથોરીટીના ટેક્ષ વિગેરે જેવો તમામ ખર્ચ/લખી લેનારે ભોગવવાનો છે અને ભવિષ્યની જે કાંઈ વધારાની સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરવાની આવે તો તે તમામ રકમ ભરવાની જવાબદારી તમો/વેચાણ લેનારની છે.

(૩) સદર નીચે પરિશિષ્ટમાં જણાવેલ વેચાણ આપેલ મિલકત તમો / વેચાણ રાખનારને નળ, ડ્રેનેજ, લાઈટ, ટોઈલેટ, બાથરૂમ, કોમન લીફ્ટ વિગેરે તમામ સુવિધાઓને લગતાં તમામ પ્રકારના હકકો સહ, હવા ઉજાસ તથા સુખાધીકારના હકકો સાથેની તથા તેને લાગતા વળગતા એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષ આંતરીક તથા સહીયારા રસ્તાના તથા પાણી નિકાલના સર્વે પ્રકારના હકકો સાથેની મિલકતના તમામ પ્રકારના કોમન હકકો સાથેની તથા "આયાત પેલેસ" ના સભાસદ તરીકેના તમામ હકકો યાવત ચંદ્ર દિવાકરો, કુલ અભરામ દાવે સુરજ ચંદ્ર તપે ત્યાં સુધીના હકકો તથા અધિકાર સાથે આજરોજ વેચાણ આપવામાં આવેલ છે. સદર પરિશિષ્ટમાં જણાવેલ મિલકતના તમો / પ્રથમ પક્ષવાળા આજથી માલિક થયા છો અને આ મિલકતનો માલીકી હકક કોમ્પલેક્ષના નિયમોને આધિન રહીને તમારે ઉપયોગ અને ઉપયોગ કરવા તથા કરાવવાનો છે. સદર પરિશિષ્ટમાં જણાવેલ મિલકત ઉપર તમો આજથી સંપૂર્ણ હકક ધરાવો છો અને તેમાં અમો તથા અમારા વંશ, વાલી, વારસદારોનો કોઈપણ જાતનો લાગ, ભાગ, હકક, હિસ્સાનો સંબંધ રહેતો નથી.

(૪) સદર "આયાત પેલેસ" નામની યોજના પૈકી નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલકત સદર વેચાણ દસ્તાવેજથી તમોને વેચાણ આપેલ છે. તેથી કોમ્પલેક્ષના બેઝમેન્ટ/ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ કોમન પાર્કિંગની જગ્યા તમામ સભાસદો / મેમ્બરોએ કોઈને આવવા-જવામાં અડચણ રૂપ ન થાય તે રીતે પાર્કિંગ કરવું-કરાવવાનું છે. તમામ સભાસદોએ અનુકુળતા મુજબ પાર્કિંગ માટે મળેલ જગ્યામાં જ પાર્કિંગ કરવું-કરાવવાનું છે અને તમામ સભાસદોએ / મેમ્બરોએ પાર્કિંગની જગ્યામાં કોઈપણ જાતનું પાર્કિંગ અર્થે અથવા અન્ય કોઈપણ અર્થે બાંધકામ કરવું-કરાવવાનું નથી.

(૫) અમો / લખી આપનારે તમો / લખી લેનારને વેચાણ આપેલ મિલકતના તમો સ્વતંત્ર માલિક છો અને સદર વેચાણ દસ્તાવેજના આધારે સદરહું મિલકત સીટી સર્વે કચેરી, મહાનગર સેવાસદન કચેરી, પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી., રેવન્યુ દફતરે તથા સરકારી તેમજ અર્ધ-સરકારી તથા અન્ય સંસ્થા વિગેરેમાં તમો/વેચાણ રાખનારના નામે કરાવી શકશો. આ માટે અમો / લખી આપનારની જ્યાં જ્યાં અમને જ્યારે જ્યારે સહી-સમંતીની જરૂર પડે ત્યાં અને ત્યારે તે તમામ તમો / લખી લેનારને કરી આપવા માટે કાયદેસર બંધાયેલા છીએ.

- (૬) સદર વેચાણ આપેલ મિલકત "આયાત પેલેસ" નામની યોજનામાં આવેલ છે. તેથી કોમ્પલેક્ષના તમામ સભાસદો/મેમ્બરો ભેગા મળીને જાળવણી, સાચવણી, સફાઈ, નીભાવણી, કોમન મેન્ટેનન્સ, ચાર્જીસ માટે વિકાસ મંડળ કે એશોસીએશનની રચના કરવામાં આવે તો તેમાં તમો/લખી લેનાર ફરજીયાત સભાસદ/મેમ્બર થવાનું રહેશે. તેથી સદર કોમ્પલેક્ષના તમામ સભાસદોએ જે કાંઈ સહીયારા હકક અને અધિકાર મળવા પાત્ર છે તે તમામ તમો મેળવાને હકકદાર છો અને વહીવટ ખર્ચ, કોમન સુવીધા માટે વરાડે/સરખા ભાગે આવતો ખર્ચ પણ તમારે આપવાનો રહેશે. કોમન પેસેજ તથા લીફ્ટમાં અન્ય કોઈને પણ કોઈને અડચણ રૂપ થાય તેવો માલ-સામાન મુકવાનો નથી તથા તમામ સભાસદોને સહકાર આપવાનો રહેશે તેવી સ્પષ્ટ સમજૂતી અને શરતથી સદર વેચાણ દસ્તાવેજ તમોને લખી આપવામાં આવેલ છે.
- (૭) સદર નીચે પરિશિષ્ટમાં જણાવેલ કોમ્પલેક્ષની બહાર બાલ્કની, ગ્રીલ, કલર, તથા એલીવેશનમાં કોઈપણ મેમ્બર/સભાસદોએ કોઈપણ જાતનો ફેરફાર કરવાનો નથી. સદર કોમ્પલેક્ષના સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જેવો કે બીંબ કે કોલમમાં સુધારો-વધારો કોઈપણ સંજોગોમાં હાલમાં કે ભવિષ્યમાં થઈ શકશે નહીં તેમજ સદર સમગ્ર "આયાત પેલેસ" નામની યોજનાના લોકલ ઓથોરીટીમાં બાંધકામ અર્થે મંજૂર કરેલ નકશામાં દર્શાવ્યા મુજબ ખુલ્લી જમીનમાં કોઈપણ પ્રકારે કોઈપણ સભાસદ/મેમ્બર હાલમાં કે ભવિષ્યમાં અંગત માલીકી માંગી શકશે નહીં. તે જમીન કાયમને માટે ખુલ્લી રાખવા વેચાણ રાખનાર તથા સમગ્ર યોજનાના અન્ય સભાસદો બંધાયેલા છે અને રહેશે.
- (૮) નીચે પરિશિષ્ટમાં જણાવેલ વેચાણ આપેલ મિલકતની જે દિવાલો બાજુની મિલકત સાથે લાગીને આવેલ છે તે તથા સ્લેબની ઉપર-નીચે તમામ દિવાલો તે બંનેની સહીયારી ગણાશે અને તેનું માપ દિવાલના મધ્યબિંદુથી ગણવાનું છે.
- (૯) ભવિષ્યમાં તમો/ વેચાણ રાખનાર નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલકત વેચાણ અથવા તબદીલ અથવા ગીરો કરો ત્યારે સદર વેચાણ દસ્તાવેજથી તમોને જે હકકો અને અધિકારો મળેલ છે, ફક્ત તે જ મળેલ હકકો અને અધિકારો તથા સદર વેચાણ દસ્તાવેજમાં જણાવેલ ઉપરના નીયમો તથા શરતોને તથા વખતોવખત બનાવાવમાં આવેલ નીયમોને આધિન હકકો અને અધિકારો સહ વેચાણ અથવા તબદીલ અથવા ગીરો કરી શકશો તેવી સ્પષ્ટ શરત સહ સદર વેચાણ દસ્તાવેજ લખી આપેલ છે.

(૧૦) કબજો લેવાની તારીખ કાર્યવાહી : પ્રમોટર, સક્ષમ સત્તાધિકારી પાસેથી ઓક્યુપન્સી/કમ્પલીશન સર્ટીફિકેટ મેળવ્યા બાદ અમે એલોટી દ્વારા સદર કરાર મુજબ નાણાંની ચકવણી થયા બાદ ૩-મહિનાની અંદર એલોટીને એપાર્ટમેન્ટ/ કોમ્પલેક્ષનો કબજો સોંપશે. પ્રમોટરએ બાબતે ખાતરી આપે છે કે પ્રમોટરના પક્ષે પૂર્ણ કરવાની આવતી કોઈપણ પ્રકારની જોગવાઈ, ઔપચારિકતા કે દસ્તાવેજીકરણને લગતી બાબતોની પૂર્તતા તે કરી આપશે. પ્રમોટર ઓક્યુપન્સી સર્ટીફિકેટ/કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યાના દિન-૧૫(પંદર) ની અંદર તેના વતી એલોટીને એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષનો કબજો સોંપવાની કાર્યવાહી કરશે.

પ્રમોટર દ્વારા લેખીતમાં સદર એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષ ઉપયોગ માટે તૈયાર હોવાની નોટીસ મળ્યેથી એલોટી દિન-૩(ત્રણ)મહિનામાં મીલકતનો કબજો લેશે.

(૧૧) એલોટી દ્વારા એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષ કબજો લેવામાં ચુક થવી : ઉપરોક્ત મુદ્દા મુજબ પ્રમોટર દ્વારા લેખિત સૂચના મળ્યેથી, એલોટી સદર કરારમાં દર્શાવેલ આવશ્યક ક્ષતિપૂર્તિઓ, બાંહેધરીઓ અને દસ્તાવેજોની પૂર્તતા કર્યા બાદ કબજો લેશે અને પ્રમોટર એલોટીને એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષનો કબજો સોંપશે. જો એલોટી મુદ્દામાં દર્શાવેલ સમયમર્યાદામાં કબજો લેવામાં નિષ્ફળ જાય કે ચુક કરે તેવા સંજોગોમાં એલોટી લાગુ પડતા મેન્ટેનન્સ ચાર્જ ચુકવવા બંધાયેલ છે.

(૧૨) સદર એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષનો કબજો એલોટીને સોંપ્યા બાદ પાંચ વર્ષના સમયગાળાની અંદર એલોટી એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષની અંદર અથવા તો બિલ્ડીંગ જ્યાં એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષ સ્થિત છે તેમાં, કોઈપણ પ્રકારની માળખાકીય ક્ષતિ અથવા કામગીરી, ગુણવત્તા કે સેવાની જોગવાઈને કારણે ઉદભવેલ ક્ષતિ પ્રમોટરના ધ્યાને લાવે, તેવા સંજોગોમાં, શક્ય હોય ત્યાં પ્રમોટરે પોતાને ખર્ચે આવી ક્ષતિ સુધારી આપશે અને જો તે રીતે ક્ષતિપૂર્તિ શક્ય ન હોય તો એલોટી પ્રમોટર પાસેથી કાયદામાં સુચવે પધ્ધતિએ વળતર મેળવી શકે છે. જો કે પ્રમોટરના નિયંત્રણ બહારની હોય તેવી કોઈપણ પ્રકારની માળખાકીય ક્ષતિ અથવા કારીગરી, ગુણવત્તા કે સેવાની જોગવાઈની ક્ષતિપૂર્તિ માટે પ્રમોટર જવાબદાર રહેશે નહીં.

(૧૩) સદર કરારમાં દર્શાવેલ એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષ કે તેના કોઈપણ ભાગને લગતી બાબતનો કાનુની હેતુ માટે ઉપયોગ થઈ શકશે નહીં. સદર કરારની રૂએ એલોટીને વેચવામાં આવેલ એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષ સહીતની ખુલ્લી જગ્યા, પાર્કીંગ સ્પેશ, લોબી, દાદર, ટેરેસ વગેરે પર એલોટી પોતાનો દાવો કરી શકશે નહીં જ્યાં સુધી તે સદર કરારમાં દર્શાવ્યા મુજબ હસ્તાંતરિત કરવામાં ન આવેલ હોય.

(૧૪) અલોટીસ એસોશિએશન :

પ્રયોજકે પ્રોજેક્ટનું ઓક્યુપન્સી સર્ટીફિકેટ મળ્યાને ૩-માસની અંદર અલોટીસનું એસોશિએશન બનાવી પ્રોજેક્ટના સામાન્યવિસ્તારોના પ્રમાણસરના અવિભાજ્યહિસ્સાની સોંપણી કરી તેના વપરાશ અને મેનેજમેન્ટને લગતા તમામ હકકો અલોટીસના એસોશિએશનને સોંપી દેવાના રહેશે.

(૧૫) સમાંતરતા :

આ દસ્તાવેજની કોઈપણ જોગવાઈ અધિનિયમ અથવા તે હેઠળ ઘડેલ નિયમો અને નિયમનો હેઠળ અથવા અન્ય કોઈ લાગુ પડતા કાયદાઓ હેઠળ રદ અને બિનઅસરકારક જણાઈ આવે તો દસ્તાવેજની તેવી જોગવાઈઓને દસ્તાવેજના હેતુ સાથે વ્યાજબી રીતે અસંગત થાય તેમજ અધિનિયમ અથવા તે હેઠળ ઘડેલ નિયમો અને નિયમનો અથવા લાગુ પડતા કાયદા, જે લાગુ પડતું હોય તેને અનુકુળ રહે તેટલી હદે સુધારેલ અથવા રદ કરેલ ગણવાની રહેશે અને દસ્તાવેજની બાકીની લાગુ પડતી જોગવાઈઓ દસ્તાવેજ કરતી વખતે યોગ્ય અને અસરકારક રહેશે.

(૧૬) તકરાર નિવારણ :

પક્ષકારો વચ્ચે થયેલ કોઈપણ તકરારનો સમાધાનથી ઉકેલ લાવવાનો રહેશે. જો સમાધાન શક્ય ન હોય તો, તકરારને રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ)એક્ટ, ૨૦૧૬ની જોગવાઈઓ તેમજ તે હેઠળ ઘડેલ નિયમનો હેઠળ સત્તામંડળ તરફ સંદર્ભ કરવાનો રહેશે.

(૧૭) પ્રોજેક્ટને બી.યુ./કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યા બાદ પ્રમોટરનો FSI, વધારની FSI કે અને અગાશીના હકકો પર કોઈપણ પ્રકારનો દાવો રહેશે નહીં. ત્યારબાદ FSI વધારાની FSI અને અગાશીના હિસ્સા પર "અલોટીના એસોશિએશન" નો હકક અને દાવો રહેશે.

સદર વેચાણ દસ્તાવેજમાં બંને પક્ષકારો વચ્ચે તા. _____ ના રોજ કરવામાં આવેલ રજીસ્ટર્ડ બાનાખત (રજી.નં. _____)ની જોગવાઈઓ ગ્રાહ્ય રહેશે. રજીસ્ટર્ડ બાનાખતમાં કરેલી જોગવાઈઓ નીચે મુજબ છે.

પરિશિષ્ટ

વેચાણ આપેલ મિલકતનું વર્ણન

ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના ગામ જુનાગઢમાં મહાનગરપાલીકા હદની અંદર મહોલ્લે બુકર ફળીયા એરીયામાં આવેલ જુનાગઢ

સીટી સર્વે બ્લોક નંબર-૨૨, સીટી સર્વે નંબર-૫૬૪ ની જમીન ચોરસ મીટર ૩૦૬-૩૯-૫૧ આ. ની જમીન ઉપર રહેણાંક હેતુ માટે "આયાત પેલેસ" નામના બહુમાળી બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવેલ અને હાલ જે "આયાત પેલેસ" નામે ઓળખાય છે. આમ ઉપરોક્ત વિગતે સદરહુ જમીન ઉપર રહેણાંક હેતુ માટે બાંધવામાં આવેલ બહુમાળી ઈમારત જે "આયાત પેલેસ" ના નામથી ઓળખાય છે. જેમાં નીચે જણાવેલ મિલ્કત તમોને વેચાણ આપેલ છે.

વીંગ નંબર	ફ્લોર નં.	દુકાન/ઓફીસ/ ફ્લેટ નંબર	કારપેટ એરીયા (ચો.મી.)	સામાન્ય વિસ્તારનો પ્રમાણસરનો અવિભાજ્ય હિસ્સો (ચો.મી.)

ચર્ત:સીમા

પુર્વ :-

પશ્ચિમે :-

ઉત્તરે :-

દક્ષિણે :-

સદર વેચાણ દસ્તાવેજ અમો / બીજા પક્ષવાળા અમારી સ્વતંત્ર ઈચ્છા અને તમો /પ્રથમ પક્ષકારવાળાની મરજીથી આજરોજ વાંચી, વંચાવી, સમજી, વિચારી, દીલના સાવધ પણામાં, અકકલ હોંશીયારીથી, બીનકેફ અવસ્થામાં તેમજ કોઈપણ ધાક-ધમકી, રજૂઆત તે ગેર સમજૂતી સીવાય, સભાન અવસ્થામાં અમારી રાજીખુશીથી કરેલ છે. જે અમોને તથા અમારા વંશ, વાલી, વારસોને કબુલ મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે અને તે બદલ અમો અમારી સહી નીચે સાક્ષીઓની રૂબરૂમાં કરી આપેલ છે.

સ્થળ :

તારીખ :



લખી આપનાર / જમીન માલીક / બીજા પક્ષવાળા :

અસીમ ઈકબાલભાઈ મારફતિયા

સાક્ષી :

મિલકતનો ફોટો

રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ ની કલમ-૩૨(અ) મુજબ શિડયુલ

લખી લેનાર	ફોટોગ્રાફ	અંગુઠાનું નિશાન
		
		

લખી આપનાર	અંગુઠાનું નિશાન	
----- પ્રયોજક : અસીમ ઈકબાલભાઈ મારફતિયા		